

ત્વરિત જાહેરાત માટે

ફાયર માસ્ટર પ્લાન વૈવિધ્યસભર અને વૃદ્ધિગત સમુદાયની જરૂરિયાતોને સંબોધે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 16, 2020) – આજે, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે [બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ \(BFES\) 2021-2025 ફાયર માસ્ટર પ્લાન](#) મંજૂર કર્યો, જેમાં 32 ભલામણો સમાવેલી છે જે બ્રેમ્પટનમાં હમણાં અને ભવિષ્યમાં સતત અસરકારક અને કાર્યક્ષમ અગ્નિ સંરક્ષણ સેવાઓની ખાતરી કરાવે છે. BFES ફાયર માસ્ટર પ્લાન [2018 – 2022 સમયગાળા માટે કાઉન્સિલની અગ્રતાઓ](#)ની ઉપલબ્ધિમાં ફાળો આપે છે.

કેનેડાના બીજા નંબરે સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા શહેર તરીકે, બ્રેમ્પટનની જરૂરિયાતો અજોડ છે. BFES ફાયર માસ્ટર પ્લાનનો વિકાસ 2,000 થી વધારે બ્રેમ્પટનવાસીઓ, 200 ઉપરાંત આગવી હરોળના કર્મચારીઓ (ફાઈ-લાઈન સ્ટાફ), બહુવિધ સીટી વિભાગો અને BFES ની મેનેજમેન્ટ ટીમ સહિતના આંતરિક અને બાહ્ય હિતધારકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યો હતો. વધુમાં, વ્યાપક સામુદાયિક જોખમ મૂલ્યાંકન, સ્ટેશનના સ્થળનો અદ્યતન અભ્યાસ અને વિવિધ કાયદાકીય માહિતીથી BFES ફાયર માસ્ટર પ્લાન પર પ્રભાવ પડ્યો હતો.

આ BFES ફાયર માસ્ટર પ્લાનને ત્રણ વિષયોના સમૂહથી માર્ગદર્શન મળે છે: *સુરક્ષિત, સફળ, અને ટકાઉ*. આ વિષયો ભલામણો અને સંકળાયેલી પહેલો માટેનું માળખું પૂરું પાડે છે જેમાં પહેલો ધ્યાન આપવા જેવા નવ ક્ષેત્રોમાં ગોઠવેલી હોય છે: કટોકટીમાં પ્રતિભાવ; આગ રોકથામ અને શિક્ષણ; કટોકટીમાં સંચાલન; સામુદાયિક સુરક્ષા; નિષ્પક્ષતા અને સમાવેશ; ટેકનોલોજીવક્ષી શોધ; સશક્ત કર્મચારીઓ; સુશાસન; અને પર્યાવરણવક્ષી સ્થિરતા.

પ્લાનની મુખ્ય કામગીરીઓમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય છે:

- શહેરના વિકાસની ગતિને અનુરૂપ રહેવા આગામી દસ વર્ષોમાં ત્રણ નવા ફાયર સ્ટેશન્સનું નિર્માણ કરવું;
- ઉચ્ચતર-જોખમ ધરાવતા ભોગવટાઓ માટે અનુપાલન કરવાની સભ્યતા ઊભી કરવા હાઈ-રાઈઝ, લો-રાઈઝ અને પંસદગીના ઔદ્યોગિક ભોગવટાઓ માટે વધારે સારા નિયમિત નિરીક્ષણ કાર્યક્રમનો અમલ કરવો;
- આગ લાગવાની સૌથી વધારે શક્યતાની ધારણા બાંધવા નવી મશીન લર્નિંગ અને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો લાભ લેવો જેથી કરીને આગ લાગવાની શક્યતા અને તેનું પ્રમાણ ઘટાડવા પહેલેથી સક્રિય બનીને લક્ષ્યાંકિત નિરીક્ષણો કરી શકાય છે;
- ભરતીની નવીન યુક્તિઓના અમલમાં આવરી લેવાતો સમુદાય વધારે સારી રીતે પ્રતિબિંબિત થાય તે માટે અસરકારક રીતે ધ્યાન આપીને ડિપાર્ટમેન્ટની વિવિધતા, નિષ્પક્ષતા અને સમાવેશ પ્રયત્નો વધારે સારી રીતે કરવા.

આગ સામે ઉચ્ચ સ્તરીય સંરક્ષણ સેવાઓ આપવાનું શક્ય બનાવવાની ખાતરી કરવા BFES ફાયર માસ્ટર પ્લાનમાં સમય જતા વિકાસ થશે. સંપૂર્ણ BFES ફાયર માસ્ટર પ્લાન વાંચવા વેબસાઈટ જુઓ, www.bramptonfire.com.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ એક અગ્રણી, નવીન ફાયર સર્વિસ છે, અને BFES ફાયર માસ્ટર પ્લાન આપણાં વૃદ્ધિગત અને આશ્ચર્યજનક રીતે વૈવિધ્યસભર શહેરની અજોડ જરૂરિયાતોને હમણાં અને ભવિષ્યમાં ટેકો આપે છે. BFES ફાયર માસ્ટર પ્લાનનો વિકાસ થવાથી, આપણી ટીમ એ ખાતરી કરાવવાનું ચાલુ રાખી શકે છે કે બ્રેમ્પટન એક સુસંચાલિત (વેલ-રન) શહેર રહે અને પ્લાનથી કટોકટીમાં વ્યવસ્થાપન અને પ્રતિભાવ આપવામાં શ્રેષ્ઠ પરિણામો મળી રહે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી બ્રેમ્પટન ફાયર અને ઈમરજન્સી સેવાઓ આપતી ટીમ બ્રેમ્પટનને આરોગ્યપ્રદ અને સુરક્ષિત સમુદાય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. BFES ફાયર માસ્ટર પ્લાન ખાતરી કરાવે છે કે આપણાં રહેવાસીઓને આજે અને ભવિષ્યમાં સુરક્ષિત રાખવા આપણે સુઆયોજિત અભિગમ અપનાવીએ છીએ.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણું વૈવિધ્યસભર શહેર વૃદ્ધિ પામી રહ્યું છે ત્યારે, આપણે ભવિષ્ય માટે તૈયાર હોવાની ખાતરી કરવા અમારી ટીમે સતત મૂલ્યાંકન કરતા રહેવાની અને વિકસિત થવાની જરૂર પાણ છે. અમારો BFES ફાયર માસ્ટર પ્લાન અમને તે કાર્યમાં માર્ગદર્શન આપશે. મને આ વ્યાપક યોજના માટે કરેલા કામ પર ગૌરવ છે, અને મને ખાસ કરીને અમે સેવા આપીએ છીએ તેવા વૈવિધ્યસભર સમુદાયને વધારે પ્રતિબંધિત કરતી એક ટીમ બનાવવા કામ કરવાની પહેલી ફાયર સર્વિસીસમાંની એક હોવાનું ગૌરવ છે.”

- બિલ બોયસ (Bill Boyes), ફાયર ચીફ, બ્રેમ્પટન ફાયર અને ઈમરજન્સી સેવાઓ

“અમે સેવા આપવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવા હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. આપણું શહેર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે ત્યારે, BFES ફાયર માસ્ટર પ્લાન ખાતરી કરાવે છે કે અમે બ્રેમ્પટનમાં રહેતા, કામ કરતા, અભ્યાસ કરતા અને રમતો રમતા લોકોને પ્રગતિશીલ ફાયર અને ઈમરજન્સી સેવાઓ આપીને શહેરની આ વૃદ્ધિને સહાયરૂપ થવા તૈયાર છીએ.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca